

પ્રકરણ - ૧૨

કુટુંબ નિયોજન



તમે
શું
ઈચ્છા હો ?



કુટુંબ નિયોજન અપનાવો જીવન સુખી અને સંતુષ્ટ બનાવો.

વિષયસૂચિ :

- ૧.૦ કુટુંબ નિયોજનના ફાયદા
- ૨.૦ કુટુંબ નિયોજન અપનાવવાની પસંદગી
- ૩.૦ ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી
- ૪.૦ આડશા પદ્ધતિ
- ૪.૧ પુરુષ નિરોધ (Male condom)
- ૪.૨ સ્ત્રી નિરોધ (Female condom)
- ૪.૩ આડશાટોપી (Diaphragm)
- ૪.૪ શુકાણુ નાશક રસાયણ (Spermicides)
- ૫.૦ અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ
(Hormonal Methods)
- ૫.૧ ગર્ભનિરોધક ગોળીઓ

- ૫.૨ આરોપણ કેપ્સ્યુલ (Implants)
- ૫.૩ ગર્ભનિરોધક ઈન્જેક્શન
- ૬.૦ ગર્ભશયમાં મૂકવાના સાધન
(Intrauterine Devices)
- ૭.૦ કુદરતી પદ્ધતિઓ
- ૮.૦ પારમ્પરિક કે ઘરગણ્ય પદ્ધતિઓ
- ૯.૦ કાચમી ગર્ભનિરોધની પદ્ધતિઓ
૧૦. તાત્કાલિક ગર્ભનિરોધ પદ્ધતિઓ
૧૧. નવી પદ્ધતિઓ
૧૨. ગર્ભનિરોધની પસંદગી
૧૩. પરિવર્તન માટે પ્રયાસ

કુટુંબ નિયોજન

તમારે જેટલા બાળકો જ્યારે જેઠીતા હોય ત્યારે જ થાય તેવા આયોજન અને તે માટેની પદ્ધતિઓને કુટુંબ નિયોજન કહેવાય.

દર વર્ષે લાખો લીઓ સગર્ભાવસ્થા, બાળજન્મ અને અસલામત ગર્ભપાત, વગેરે કારણોસર મૃત્યુ પામે છે. આ આંકડો ઓછો કરવા માટે ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે. તેમાં એક પ્રયત્ન તે લીઓમાં સગર્ભાવસ્થા જ ઓછી આવે તે છે. લીઓને જરૂરી અને ઈચ્છિત બાળકો જ થાય અને બિનજરૂરી સગર્ભાવસ્થા નિવારી શકાય તે માટે કુટુંબ નિયોજનની જુદ્દી જુદ્દી રીતો અપનાવવામાં આવેલ છે. આ પદ્ધતિઓથી જલ્દી જલ્દી આવતી સગર્ભાવસ્થા, ખૂબ મોટી ઉમરે સગર્ભાવસ્થા, ખૂબ નાની ઉમરની સગર્ભાવસ્થા અને ઘણી વધારે સગર્ભાવસ્થાઓ નિવારી શકાય છે.

ગરીબ અને વિકાસશીલ દેશોમાં લીઓના મૃત્યુમાંથી લગભગ અડધા બેનો સગર્ભાવસ્થા/બાળજન્મમાં થતી મુશ્કેલીઓને લીધે ભરી જય છે. કુટુંબ નિયોજન અપનાવવાથી સગર્ભાવસ્થા અટકાવી શકાય છે. તેથી મરણનો પ્રશ્ન રહેતો નથી/ઓછો થાય છે.

૧.૦ કુટુંબ નિયોજનના ફાયદા

૧. માતા અને બાળકો વધુ તંદુરસ્ત બને, કારણ કે ઓછા બાળકો હોય તો કુટુંબમાં સૌને વધુ કેટલીક જોખમી સગર્ભાવસ્થા નિવારી શકાય.
૨. ઓછા બાળકો હોય તો કુટુંબમાં સૌને વધુ ખોરાક મળી શકે. લીઓનું સ્વાસ્થ્ય સુધરે



૩. સગર્ભાવસ્થા મોડી આવવાથી જુવાન લી-પુરુષોને ભણવા માટે પૂરતો સમય અને તક મળી શકે.
૪. ઓછા બાળકો હોય તો તમને અને તમારા પતિને પોતાને માટે અને બાળકો માટે પૂરતો સમય મળી રહે છે.



૫. ગર્ભનિરોધક પદ્ધતિઓ વાપરવાથી સગર્ભા થવાનો ડર નથી રહેતો તેથી તમારું અને તમારા સાથીનું સહજલવન વધુ સમૃદ્ધ બને.
૬. જતીય રોગોથી બચવા માટે નિરોધ જેવું સાણું બીજું સાધન નથી.
૭. હોમોનવાળી રીતોથી માસિક નિયમન પણ કરી શકાય છે.
૮. કુટુંબ નિયોજન સ્વાસ્થ્ય માટે સલામત છે.


આ પ્રકરણમાં વર્ણન કરવામાં આવેલી મોટાભાગની પદ્ધતિઓ ઘણા વર્ણાથી લાખો લીઓ અને પુરુષોએ વાપરેલી છે. તે મોટા ભાગે સલામત પણ છે. કેટલીક પદ્ધતિઓની આડઅસર થાય છે જેનો ઉપાય શક્ય છે અથવા થોડા સમય બાદ શરીર ટેવાઈ જય છે.

જ્યારે એક લાખ લીઓ સગર્ભા થાય છે,
ત્યારે ૫૦૦ બેનો સગર્ભાવસ્થા કે
સૂવાવડના કારણે મરણ પામે છે.

જ્યારે એક લાખ બેનો ગર્ભનિરોધક
પદ્ધતિઓ વાપરે છે ત્યારે ૬ ૯ બેનો
આ પદ્ધતિને કારણે મરી જય છે.



મરણનું જ્ઞાન



જે કે, માતૃ મરણ ઘટાડવાના ઉપાય તરીકે ગર્ભનિરોધક પદ્ધતિઓને ન ગણવી જોઈએ. કારણ કે, જે સમાજમાં લીઓને નબળી બનાવનાર બીજા રોગ (દા.ત. કુપોષણ, ટીબી, મેલેરિયા વગેરે) વધુ પ્રમાણમાં થાય છે ત્યાં બેનોને સગર્ભાવસ્થામાં મરણની સંભાવના વધુ હોય છે, વળી જ્યાં પ્રસૂતિ અને લી સ્વાસ્થ્ય અંગેની સારી સુવિધાઓ જલ્દીથી મળી શકતી નથી, ત્યાં માતૃમરણ વધુ થાય છે. તેથી માતૃમરણ ઘટાડવું હોય તો, લીસ્વાસ્થ્યને અસર કરનારા આ બીજા પરિબળો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઇતાં ગર્ભ નિરોધ વધુ પ્રયત્નિત થાય તો લીસ્વાસ્થ્ય સુધરી શકે છે.

કુટુંબ નિયોજન

૨.૦ કુટુંબ-નિયોજન અપનાવવાની પસંદગી

કેટલીક બેનોને વધુ બાળકો જોઈએ છે. દા.ત. આપણા સમાજમાં ગરીબ લોકોને પૂરતી તકો નથી મળતી અને તેઓ પાસે ઓછું ધન, ઓછી જમીન છે. જે સમાજમાં સંસાધનોનું ન્યાયી વિતરણ નથી થતું, એવા સમાજમાં વધુ બાળકો હોય તો કુટુંબ માટે વધુ આવક મેળવી શકાય છે. બધા બાળકો નાનું-મોટું કામ કરી કુટુંબ ચત્તાવવા માટે જરૂરી સાધનો લાવી શકે છે. આવા સમાજમાં પૈસાવાળા થોડાક લોકો જ ઓછા બાળકો ઈચ્છે છે.

તો વળી જે સમાજમાં છોકરીઓને ભણવાની અને સ્વવિકાસની તકો મળી શકે છે, તે સમાજમાં સ્ત્રીઓ ઓછા બાળકો પસંદ કરે છે. કારણ કે ઓછાં બાળકો હોય તો તેઓને ભણવા-ગણવા અને કમાવા માટે પૂરતો સમય મળી શકે. વળી, આ સમાજની સ્ત્રીઓ પુરુષો સાથે સમાનસ્તરે ચર્ચા કરી શકે છે અને કુટુંબ નિયોજન અપનાવવાનો આગ્રહ પણ રાખી શકે છે.

મુદ્દાની વાત એ છે કે સ્ત્રી ગમે તે સમાજમાં જીવતી હોય પણ જે તે પોતે કેટલા બાળકો હોવા અને ક્યારે સગર્ભા થવું છે, તે નિર્ણયો કરી શકે તો તે વધુ સ્વનિયંત્રિત જીવન જીવે છે. વળી તે વધુ તંદુરસ્ત પણ રહી શકે છે.

યાદ રાખો કે કુટુંબ નિયોજન અપનાવું કે ના અપનાવું તે તમારો હક્ક છે. તે બાબત કોઈ આરોગ્ય સેવાઓ, સરકાર કે ધર્મગુરુઓ પોતાના નિર્ણય તમારા પર લાદી ના શકે.

શક્ય હોય ત્યાં સુધી તમારા પતિ સાથે આ બાબત ચર્ચા કરી નિર્ણય કરો. મોટાભાગે પુરુષોને આ અંગે માહિતી હોતી નથી. તેથી તેઓ પદ્ધતિઓ વાપરવાની ના પાડે છે. ઘણી વાર તેઓને ગર્ભનિરોધક સાધનોની આડઅસરનો ડર હોય છે, માટે પણ ના પાડે છે. ઘણીવાર પુરુષ સ્ત્રી પર શંકા રાખે છે કે, પદ્ધતિ અપનાવવાથી તેની સ્ત્રી બીજા પુરુષ જેઠે પણ સંબંધ રાખશે. તેથી તેઓ જે તે પદ્ધતિ અપનાવતા નથી. આવા સંભેગોમાં તેમને સાચી જ્ઞાનકારી આપવાથી બંનેનું જીવન સરળ બને છે. ઘણીવાર માન્યતાને કારણે વધુ બાળકો હોય તેને પુરુષો પોતાની મર્દાનગીની નિરાની માને છે તેથી કુટુંબ નિયોજન અપનાવતા નથી. કેટલીક જગ્યાએ ધાર્મિક માન્યતાઓને કારણે કુટુંબ નિયોજન અપનાવતાં તેઓ અચકાય છે.

સ્ત્રીઓએ આ બધું સમજીને કુટુંબ નિયોજનને પોતાના ફાયદા માટે અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પુરુષોને જુદી જુદી રીતે સમજવી શકાય છે. જે સ્ત્રીઓ જતીય જીવન અને બાળકો હોવા કે ન હોવાનો નિર્ણય પોતાના હાથમાં રાખી શકે છે તેમનું જીવન વધુ સરળ અને સુખી બને છે.

૩.૦ ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી

એક વાર તમે પદ્ધતિ વાપરવાનું નક્કી કરી લીધું ત્યાર પછી કઈ પદ્ધતિ તમે વાપરશો તેની પસંદગી કરવાની હોય છે. સાચો નિર્ણય તમે લઈ શકો તે માટે તમારે જુદી જુદી પદ્ધતિ/સાધનોના ગુણ-દોષ બરાબર સમજુ લેવા જોઈએ અને પોતાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરવો જોઈએ.

પાંચ પ્રકારના સાધનો ઉપલબ્ધ હોય છે :

૧. આડશ પદ્ધતિ (બેસિયર મેથડ્સ) : તેનાથી પુરુષભીજ અને સ્ત્રીભીજની વર્ચ્યે આડશ થઈ જાય છે જેથી તેઓનું ફલિનીકરણ ના થાય.
૨. અંતઃસ્ત્રાવ પદ્ધતિ (હોર્મોનલ મેથડ્સ) : જે લેવાથી સ્ત્રીના બીજશયમાંથી બીજ છૂંઠ પડતું નથી તેથી ફલિનીકરણનો પ્રસંગ જ ના થાય અને ગર્ભ રહેતો નથી.
૩. ગર્ભાશયની અંદર મૂકવાના સાધન (ઇન્ટ્રાયુટેરાઇન ડીવાઈસીસ) : ગર્ભાશયમાં આવા સાધનની હાજરીને કારણે શુકાણુ અને સ્ત્રી બીજનું ફલિનીકરણ થતું નથી અને તેથી ગર્ભ રહેતો નથી.
૪. કુદરતી સમય ગાળો/પદ્ધતિ (નેચરલ મેથડ્સ) : આનાથી સ્ત્રીને ખબર પડે છે કે તેને કયારે ગર્ભ રહી શકે તેમ છે. તેથી તે સમયગાળામાં સમાગમ ટાળે તો તેને ગર્ભ રહેતો નથી.
૫. કાયમી પદ્ધતિ (પર્મેનન્ટ/ટર્મિનલ મેથડ્સ) : ઓપરેશન દ્વારા સ્ત્રી કે પુરુષની બીજનળી કાપી નાંખવામાં/બંધ કરી હેવામાં આવે છે. તેથી તે હંપતિને ફરી બાળક થઈ શકતું નથી.

હવે પછી જે પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાંથી એક કે બે પદ્ધતિ તમારે પસંદ કરવાની છે તે માટે તમે અને તમારા પતિ નીચેના પ્રશ્નો ધ્યાનમાં લો.





- * પદ્ધતિ/સાધન સગર્ભાવસ્થા રોકવામાં કેટલું અસરકારક છે ?
- * તેની આડ અસરો શું છે ?
- * તે વાપરવાનું તમારે માટે સરળ છે ?
- * તમારા પતિ તે વાપરવા તૈયાર છે ?
- * બજલરમાંથી ખરીદવાની હોય તો તેની કિંમત શું છે ?
- * તેને માટે વારંવાર આરોગ્ય કેન્દ્ર કે દુકાને જવું પડશે ?
- * તેની આડઅસરોથી તમે કોઈ સામાજિક મુશ્કેલીમાં ફસાશો ? તમારા પતિ, આરોગ્યરક્ષક કે કોઈ પણ અનુભવી સ્ત્રી સાથે ચર્ચા કરવાથી તમને જરૂર ફાયદો થશે જ.

તમારે માટે કઈ પદ્ધતિ બરાબર છે તે ફક્ત તમે જ નક્કી કરી શકો.

કુટુંબ નિયોજન

પદ્ધતિની અસરકારકતા : પદ્ધતિ વાપરનાર દર સો ક્રીઓ/દંપત્તિમાંથી કેટલાને સગર્ભાવસ્થા થઈ શકે છે તે નીચે આપેલ છે. વળી તે જતીય રોગમાં રક્ષણ આપે કે નહિ તે પણ જણાવ્યું છે.

| પદ્ધતિનું નામ | ગર્ભ રહેવાની (દર સો ક્રીએ) શક્યતા | જતીય રોગથી રક્ષણ | |
|--------------------------------|---|---------------------|---------------|
| નિરોધ |  | ૧૨ | સારું આપે |
| ક્રી નિરોધ |  | ૨૦ | સારું આપે |
| આડશા/અવરોધક ટોપી (ડાયાફ્રામ) |  | ૧૮ | બહુ થોડું આપે |
| શુક્કાણું નાશકો |  | ૨૦ | " |
| ગર્ભનિરોધક (બે રસાયણવાળી) ગોળી |  | ૩ | બિલકુલ નહીં |
| પ્રોજેસ્ટીનની ગોળી |  | ૫ | " |
| આરોપણ કેપ્સ્યુલ (ઇમ્પ્લાન્ટ) |  | ૧ થી ઓછી | " |
| ઇન્જેક્શન |  | " | " |
| ગર્ભાશયમાં મૂકવાના સાધન |  | ૧ | " |
| ધાવણ આપવું (૬ માસ સુધી) |  | ૨ | " |
| કુદરતી રીત |  | ૨૦ | " |
| ઓપરેશન |  | ૧ થી ઓછી | " |
| કોઈ પદ્ધતિ નહીં | | ૮૫ | " |

ઉપર જણાવેલ પદ્ધતિઓમાંથી ગર્ભનિરોધક ગોળી (બે રસાયણવાળી) અને ઇસ્ટ્રોજનવાળા ઇન્જેક્શન સિવાય બધી પદ્ધતિઓ ધાવણ આપતી માતાઓ વાપરી શકે છે.

૪.૦ આડશ પદ્ધતિ

શુક્કાણુ અને સ્વીબીજની વચ્ચે આડશ તરીકે કામ કરનાર સાધન ગર્ભ રહેતો અટકાવવા માટેનું સારું સાધન છે. કારણ કે તેના ઉપયોગથી સ્વી કે પુરુષના શરીરની કુદરતી પ્રક્રિયાઓમાં કોઈ પણ ફેરફાર આવતો નથી.

૪.૧ પુરુષ નિરોધ

નિરોધના ઉપયોગથી તમારા સાથીને લાગેલ જતીયરોગ તમને લાગશે નહિ તે ફાયદો પણ છે. જ્યારે તમે સગર્ભાવસ્થા ઠચ્છો ત્યારે નિરોધ નહીં વાપરો તો વહેલામાં વહેલી તકે સગર્ભા બની શકશો.

તે વાપરવાથી પુરુષો વધુ લાંબો સમય સમાગમ માણી શકે છે. (શિક્ષ જલ્દી ઢીલું થઈ જતું નથી.)

નિરોધ રખરની બનેલી નાની કોથળી છે. પુરુષ પોતાના શિક્ષ પર સમાગમ વખતે નિરોધ પહેરે તો ગર્ભ રહેતો નથી કે જતીયરોગ ફેલાતો નથી. લેટેક્સના બનેલા નિરોધ જતીયરોગ સામે પૂરેપુરું રક્ષણ આપે છે. પ્રા. આ. કેન્દ્રમાંથી કે એઇઝ્સ પ્રતિરોધક કાર્યક્રમો ચલાવનાર કેન્દ્રમાંથી પણ નિરોધ મફત મળે છે. તે બજારમાંથી પણ ખરીદી શકાય છે.

તેનું પડીકું ખોલતી વખતે નિરોધ ફાટી ન જય તેનું ધ્યાન રાખો. પડીકામાંથી કદક થઈ ગયેલું કે રખર ઓગળવાથી ચીકળું થઈ ગયેલું નિરોધ નીકળે તો તે ફેરી હો.

શિક્ષ ટ્યૂર થાય એટેલે તરત જ નિરોધ પહેરી લેવું જોઈએ. તે પહેલાં શિક્ષ યોનિમાં જય કે તેનો અન્ય રીતે સંપર્ક કરે તો કેટલીકવાર ગર્ભ પણ રહી જય છે અને જતીય રોગ સામે રક્ષણ મળતું નથી. કોઈ વાર શુક્કાણુ છંટકાવ પહેલાં પણ છૂટક છૂટક શુક્કાણુ શિક્ષમાંથી બહાર આવતા હોય છે. તેથી આવો સંપર્ક રાળવો. જે નિરોધ સમાગમ દરમ્યાન કોઈ પણ કારણસર છટકી જય કે નીકળી જય તો સ્વીચે તરત જ શુક્કાણુનાશક રસાયણ લગાવી લેવું અથવા આગળ વાળવેલ કુદુંબ નિયોજનની ઇમર્જન્સીની રીત વાપરવી.

- * દૂરેક સમાગમ વખતે નિરોધ વાપરો.
- * આપણા રાષ્ટ્રીય કાર્યક્રમમાં મળતા કે બજારમાંથી સારી ગુણવત્તાના લેટેક્સ નિરોધ મેળવવાનો આગ્રહ રાખો.
- * નિરોધના પડીકાં પર તડકો પડવો જોઈએ નહીં.
- * નિરોધના પડીકાં પર તડકો પડવો જોઈએ નહીં.
- * નિરોધ માત્ર એક વાર વાપરો. ધોઈને ફરી વાપરવું નહીં.
- * કાપેલું કે ફાટેલું પડીકું લેવું નહીં.






આડશ પદ્ધતિઓનો વધારાનો ફાયદો છે કે સમાગમ કરનાર સ્વી કે પુરુષને જતીય રોગ થયો હોય તો તેનો ઉપયોગ કરવાથી જતીય રોગ બીજાને લાગતો નથી.

કુટુંબ નિયોજન

નિરોધ કેવી રીતે વાપરવું ?

1. શિક્ષની ટોચની ચામડી પાઈ ખેંચીને પડીકામાંથી નીકળેલ નિરોધની રીંગવાળી ટોપીને ઉક્તિની નાંખ્યા વિના ટોચ પર મૂકી દો.
2. એક હાથથી ટોપીનો છેડો પકડી રાખો અને રીંગને ટંકાર શિક્ષ પર ચઢાવો. શિક્ષ ટોચ પર નિરોધનો થોડો આલી છેડો લટકવા દો. જ્યારે શુકાણુ શિક્ષમાંથી નિકળે ત્યારે આ આલી ભાગમાં જીલાઈ જવા જેઠાયે. નહીં તો તે નિરોધની ધારમાંથી ઉભરાઈને બહાર આવશે અથવા નિરોધ કદાચ ફાઠી જય તેવી સંભાવના ન રહે.
3. નિરોધમાં શુકાણુ ઠલવાઈ જય ત્યાર પછી પુરુષે ટંકાર શિક્ષ પરથી બંને હાથે નિરોધને સાચવીને ઉતારી લેવું.
4. નિરોધ ઉતારતાં શુકાણુ બહાર ના પડે તેની કાળજ રાખો.
5. નિરોધનો છેડો ગાંઠ મારીને બંધ કરી દો અને તેને બાળી નાંખો કે બાળકો તથા ફૂતરાથી દૂર રાખવા, દાઠી દો.






૪.૨ સ્ત્રી નિરોધ : આપણા દેશમાં સ્ત્રી નિરોધ મળતા નથી અથવા ખૂબ મૌંઘા મળે છે. છતાં જે મળી શકે તો તે પણ એક સારી રીત છે. તેનાથી પણ જતીયરોગ સામે રક્ષણ મળે છે. સ્ત્રીનિરોધ અને પુરુષ નિરોધ એક સાથે વાપરવાની કોઈ જરૂર નથી.






કેવી રીતે વાપરશો ?

૧. ધીમે રહી પડીકું ખોલો. નિરોધને નુકસાન ના થાય તેની કાળજ રાખો.
૨. તેની પર બજ્જે છેડે રીંગ આવેલી છે. બંધ છેડાની રીંગ યોનિમાં જરૂર. તેને અંદરની રીંગ કહેવાય.
૩. અંદરની રીંગને આ રીતે દ્બાવો.




૪. અંદરની રીંગને યોનિમાં જવા દો.
૫. રીંગને યોનિમાં આગળ ધકેલો. બીજી છેડાની રીંગ યોનિની બહાર જ રહેવી જોઈએ.
૬. સમાગમ વખતે શિશ્ચ બહારની રીંગમાંથી પ્રવેશવું જોઈએ.



* સમાગમ પૂરો થાય એટલે તમે ઊભા થયા વગર જ બહારની રીંગને બરાબર પકડી, શુકાણુ રસ જરાય બહાર ના નીકળી જય તે રીતે નિરોધ બહાર ખેંચી લો. તેને બાળી મૂકો કે દાટી દો.

કુટુંબ નિયોજન

૪.૩ આડશાટોપી (ડાયાફ્રામ) : યોનિમાં ખૂલતા ગર્ભાશયના મુખ પર આડશાટોપી પહેરવાથી શુકાણુ ગર્ભાશયમાં જઈ શકતા નથી અને ગર્ભ રહેતો નથી. તેને શુકાણુનાશક રસાયણ સાથે વાપરવાથી યોનિમાંના શુકાણુ મરી જય છે. ગોનોરિયા તથા કલેમાઈડીયા નામના રોગાણુથી થતા જતીયરોગ પણ તેનાથી નિવારી શકાય છે. કેટલાક વહીવટી અને અમલીકરણના વિવિધ પ્રશ્નોને કારણે આ પદ્ધતિ આપણા દેશમાં કુટુંબનિયોજન કાર્યક્રમમાં દાખલ કરવામાં આવી નથી.



રબરની બનેલી આડશાટોપી વારંવાર વાપરી શકાય છે. છતાં એકાદ વર્ષ પછી તેને બદલી નાંખવી જેઠાં એ. વળી દૂરેક સ્વીને માટે અલગ માપની આડશાટોપી લેવી પડે. કેટલાક આરોગ્ય કેન્દ્રો/દવાખાનામાં નર્સ કે આરોગ્ય કાર્યક્રમોને આ માટે તાલીમ અપાયેલી હોય છે. તેઓ યોનિતપાસ (પર વેજનિયના તપાસ) કરીને તમારે માટે જરૂરી નંબર કહેશો. પછી હંમેશા એ જ નંબરની આડશાટોપી ખરીદવી.

કેવી રીતે વાપરશો ?

૧. જે તમારી પાસે ૨. ટોપીને આ રીતે પકડો. ૩. તમારા ભગોછને ખોલીને આડશાટોપીને ધીમેથી યોનિમાં સરકાવો. ધીમેથી પાછળની તરફ ધકેલો.
-
૪. ટોપી ગર્ભાશયના મુખ સુધી પહોંચી જય પછી તે બરાબર છે કે નહીં તે તપાસવા એક આંગળીથી ગર્ભાશય-મુખને અડવાથી ટોપીને સ્પર્શ થરો અને નાકની ટોચને અડકવાથી જેમ તે કડક લાગે છે તેના જેવું જણાશો.
-
૫. જે ટોપી બરાબર પહેરાઈ હશે તો પહેર્યા બાદ તમને તેની ખબર પણ નહીં પડે કે યોનિમાં તે ખૂંચતી પણ નથી.
-
૬. સમાગમ થયા બાદ આડશાટોપીને ઓછામાં ઓછું ૬ કલાક સુધી તો પહેરી જ રાખો.

કેવી રીતે કાઢશો ?



યોનિમાં આંગળી નાંખી ટોપીની ઉપલી રીંગ પાસેથી તેને બેંચી લો. તે વખતે સંડાસ જતા હોય તેમ સાધારણ જેર કરવાથી ટોપી બહાર કાઢવાનું થોડું સરળ પડે છે. કાઢીને તેને સાખુ તથા ચોખ્ખા પાણીથી ધોઈને ઠંડકવાળી જગ્યાએ સૂકાવા દો. ટોપીને અજવાળા સામે ધરીને ચેક કરો કે તેમાં કોઈ કાણાં પડ્યા નથી જે નાનું પણ છિદ્ર હોય તો બીજાવાર વાપરવા નવી ટોપી લઈ લો. આડશાટોપી વાપરવાનો મહાવરો થઈ જય પછી તે એક ખૂબ અનુકૂળ સાધન છે એમ લાગે છે. શુકાણુનાશક ના વાપરો તો પણ ગર્ભ રહેવાની શક્યતા ખૂબ ઓછી છે.

૪.૪ શુકાણુનાશકો : (શુકાણુનાશક ફીણા, જેલી, કીમ કે ગોળી) :

આ રસાયણો સમાગમ પહેલા યોનિમાં ઉત્તે મૂકવાથી પુરુષના શુકાણુનો નાશ કરે છે. તેથી ગર્ભ રહેવાની શક્યતા નથી રહેતી. નોનોક્સનોલની (nonoxynol-9) બનાવટવાળા શુકાણુનાશકો યોનિમાં ગોનોરિયા અને કલેમાઇડીયાનો ચેપ હોય તો તે પણ મટાડે છે.

સામાન્ય રીતે શુકાણુનાશકો એકલા વાપરવાને બદલે આડશાટોપી કે સ્લીનિરોધની સાથે વાપરવામાં આવે તો વધુ અસરકારક રક્ષણ મળે છે. આ રસાયણો દવાની દુકાનેથી મળે છે. જે સ્લીઓને તેના વપરાશથી બળતરા કે અન્ય આડઅસર જણાય તેઓએ તેનો ઉપયોગ કરવો નહીં.


શુકાણુનાશક ગોળી સમાગમના ૧૦-૧૫ મિનિટ પહેલાં જ યોનિમાં મૂકવી જેઠાં. ફીણા, જેલી કે કીમને મૂક્યા બાદ તરત જ સમાગમ થાય તો રક્ષણ મળે છે. જે તે મૂક્યા પછી ૧ કલાકમાં સમાગમ ન કરો તો સમાગમ પહેલાં તેને ફરી મૂકવા જેઠાં.



કુટુંબ નિયોજન

કેવી રીતે મૂકુશો ?


1. તમારા હાથ સાખૂ અને પાણીથી ધોઈ નાંખો.
2. ફીણા વાપરતા હો તો તેની બોટલ બરાબર ૨૦-૨૫ વાર હળવીને પછી તેની સાથે આવતા એપ્લિકેટર (સિરીજ જેવું મૂકવાનું સાધન-પિચકારી) માં ભરી લો.
3. ધીમે રહીને એપ્લિકેટર અથવા ગોળીને યોનિમાં શક્ય તેટલે ઉંડિ લઈ જવ અને ત્યાં છોડી દો.
4. એપ્લિકેટરનો દ્વારા દ્વારા તેથી તેમાં રહેલું રસાયણ યોનિમાં ઉંડ મુકાશો.
5. એપ્લિકેટરને ધોઈને બરાબર ઠેકાણે મૂકો. સમાગમ બાદ પણ લગભગ ૬ કલાક સુધી આ રસાયણને યોનિમાં જ રાખવું. તેને સાફ્ કરવાની કોશિશ કરવી નહીં. જરૂર પડ્યે કપડા બગડતા અટકાવવા માટે કપડું વાપરી શકો છો.



૫.૦ અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ

આ બધી પદ્ધતિઓમાં અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરવામાં આવે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીન નામના અંતઃસ્ત્રાવો અથવા તેના જેવા જ રસાયણોનો ઉપયોગ કરી આ ગોળીઓ, દંજેકશન કે ઇમ્પ્લાન્ટ બનાવવામાં આવે છે.

ગર્ભનિરોધક ગોળી
(માલા-ડી વગેરે)




ગર્ભનિરોધક ગોળીઓ.
સ્ત્રીઓએ દરરોજ એક
ગોળી લેવાની હોય છે.

ગર્ભનિરોધક દંજેકશન
(ઉપો-પ્રોવેરા નેટ-એન વગેરે)



દંજેકશન જે દર
ત્રણ માસે લેવાનું
હોય છે.

ગર્ભનિરોધક ઇમ્પ્લાન્ટ
(નોરેપ્લાન્ટ)



ઇમ્પ્લાન્ટ જે સીના
બાવડાની ચામડીમાં
મૂકવાથી પાંચ વર્ષ
ગર્ભ રહેતો નથી.

આ પદ્ધતિઓ બીજશયમાંથી સ્ત્રીભીજ છૂટું પડવા દેતા નથી. અંતઃસ્ત્રાવની હાજરીને કારણે ગર્ભશયના મુખ પાસે રહેતું પ્રવાહી વધુ ઘટ બને છે અને શુકાણુનો રસ્તો રોકે છે.

મોટાભાગની ગોળીઓ અને ઈંજેક્શનોમાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીન બંને આવેલા હોય છે તેને કોમ્બીનેશન પીલ કે ઈંજેક્શન કહેવાય છે. આ પદ્ધતિ ખૂબ સરસ રીતે કામ કરે છે. છતાં ધાવણ આપતી બેનો અને અમુક બિમારી થઈ હોય તે સ્ત્રીઓએ તેનો ઉપયોગ ટાળવો જેઠાં. આ માટે ડૉક્ટર (સ્ત્રી રોગ નિષ્ણાત)ની સલાહ અચૂક લેવી જેઠાં.

મીની-પીલ કે ઈમ્પ્લાન્ટમાં એક જ અંતઃસ્ત્રાવ (પ્રોજેસ્ટીન) હોય છે અને તે પણ ગર્ભનિરોધક બની રહે છે. વળી ધાવણ આપતી બેનો કે ઈસ્ટ્રોજનથી આઉઝસર પામતી બેનો પણ તેનો ઉપયોગ કરી શકે છે.

આ પદ્ધતિઓ સ્ત્રીઓ પોતાની મરજ મુજબ વાપરી શકે છે. તે બાબત પુરુષને જાણ થતી નથી.

આ પદ્ધતિઓથી જતીય રોગ કે એચઆઇવી સામે કોઈ રક્ષણ મળતું નથી.

જે બહેનોને છાતીમાં કેન્સર છે કે તે હોવાની શક્યતા છે, જે બહેનોને હાલ ગર્ભ છે, જે બહેનોને પદ્ધતિ શરૂ કરવાના ઉ માસ અગાઉથી અનિયમિત માસિક આવે છે, તેમણે આનો ઉપયોગ કરવો નહિ. ટીબી કે વાઈ (ઝેંચ) માટેની દવાઓ વાપરવાથી આ પદ્ધતિઓની અસર ઓછી થઈ જય છે.

સામાન્ય રીતે આ પદ્ધતિઓ વાપરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી. સરકારી કાર્યક્રમમાં આ માટે નર્સ બહેનોને ખાસ તાલીમ આપેલી હોય છે. આવી નર્સ બહેનો પાસે વિગતે તપાસ કરવ્યા બાદ જ ગોળી કે ઈંજેક્શન ઉપયોગ શરૂ કરવો.



સ્તરનું કેન્સર
થયું હોય તે સ્ત્રી



જે સ્ત્રીને ગર્ભ
રહેલો છે
તેવી આશંકા
હોય તે સ્ત્રી.



અનિયમિત માસિક
આવતું હોય તે સ્ત્રી

આ સ્ત્રીઓએ હોર્મોન પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

કુટુંબ નિયોજન

અંતઃસ્વાવી પદ્ધતિઓની આડઅસરો :

આ પદ્ધતિઓમાં સીના શરીરમાં પ્રજનનમાં કામ આવતા રસાયણો રહેલા હોય છે તેથી તેનાથી સ્ત્રીઓને ઘણી આડઅસરો થાય છે.



માથું દુઃખવું



ઉલ્ટી-ઉબકા

સ્તરમાં
સોજ



અનિયમિત
માસિક



સામાન્ય રીતે આ ચિનહો ૨-૩ માસ રહે છે અને પછી જતા રહે છે. છતાં જે તે ચાલુ રહે તો નર્સ કે ડૉક્ટરની સલાહથી પદ્ધતિ બદલવી જોઈએ.

૫.૧ ગર્ભ નિરોધક ગોળીઓ :

જે આખા માસિક ચક દરમ્યાન તમે દરરોજ ગોળી લઈ શકતા હો તો આ એક સારી પદ્ધતિ છે. તે બધી દવાની દુકાનો અને આરોગ્ય કેન્દ્રોમાંથી મેળવી શકાય છે. આરોગ્ય કેન્દ્રમાંથી તે મફત મળે છે.

ઘણી કંપનીઓ આ ગોળી બનાવે છે. પરંતુ તમારે “લો-ડોઝ” (ઓછી માત્રાવાળી) ગોળી લેવી જોઈએ. એનો અર્થ છે, જે ગોળીમાં 30 માઇકોગ્રામ (30 mcg) કે તેથી ઓછું ઇસ્ટ્રોજન હોય અને 1 mg કે તેથી ઓછું પ્રોજેસ્ટીન હોય તે ગોળી. 30 mcg થી વધુ ઇસ્ટ્રોજનવાળી ગોળી ક્યારેય ન લેવી.

મીની-પીલ અને લો-ડોઝવાળી ગોળી અલગ અલગ વસ્તુ છે. મીનીપીલમાં એક જ અંતઃસ્વાવ છે. લો-ડોઝમાં બજેનું મિશ્રણ હોય છે. તમને એક વાર જે ગોળી અનુકૂળ આવી જય તે જ માત્રાના રસાયણો વાળી બીજી જતની ગોળી લઈ શકાય છે. પરંતુ રસાયણની માત્રામાં વારંવાર વધઘટ નુકસાનકારક હોય છે.

કેટલીક બેનોને ગર્ભનિરોધક ગોળીના વપરાશથી માસિક વધુ નિયમિત બને છે, માસિકનો દુઃખાવો પણ ઘટે છે અને માસિક દરમ્યાન લોહી પણ ઓછું પડે છે. આ બધા આ ગોળીના આડફાયદા છે.

બીજી ગોળીઓ અનુકૂળ ન હોવાથી જ્યારે લો-ડોઝ ગોળી લેવાનું શરૂ કરો છો તે વખતે એકાદ માસ સુધી અન્ય ગર્ભનિરોધક પદ્ધતિ પણ તેની સાથે વાપરવાની સલાહ ડૉક્ટર આપશો.

મિશ્ર રસાયણવાળી ગોળી કોણે ના લેવી ?

અગાઉ જણાવેલ પરિસ્થિતિમાં ગોળી કહી ના લેવી. તે ઉપરાંત જે બેનોને કમળો થયો હોય, હૃદયરોગ કે લક્ષવાની બિમારી હોય કે ક્યારેય લોહીમાં ગઠાની બિમારી થઈ હોય તેવી બેનોએ પણ આ ગોળી લેવી જોઈએ નહિ. આ ઉપરાંત જે સ્ત્રી ધૂમપ્રપાન કરે છે, ૩૫ વર્ષથી મોટી છે, જે કોઈ સ્ત્રીને ડાયાબીટીસ કે વાઇનો રોગ છે કે તેનું લોહીનું દબાણ ૧૪૦/૮૦ કરતાં વધુ રહે છે, તો આ ગોળીઓ ના લેવી જોઈએ. તેઓએ આ અંગે ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

માસિક ચક દરમ્યાન દરરોજ ગોળી લેવાની હોય છે. પરંતુ કોઈ કારણસર તમે તે ચૂકી જવ તો જ્યારથી યાદ આવે ત્યારથી ગોળી પાછી શડુ કરો અને એકાદ માસમાં આરોગ્ય કેન્દ્રમાં જઈ ગર્ભ રહી ગયો છે કે નહિ તેની તપાસ કરાવી લેવી.

ધાવણ આપતી બેનોએ ઇસ્ટ્રોજન વાળી ગોળી લેવી નહિ કારણે તેનાથી ધાવણ ઓછું થાય છે અને બાળકને પૂરતું પોષણ નથી મળતું.

જે તમને આરોગ્યલક્ષી તકલીફ હોય તો ગોળીની બદલે નિરોધક પદ્ધતિઓ વાપરવી જોઈએ. પરંતુ જે તમે તેમ ના જ કરી શકતા હો અને તમારે ગર્ભ ના જેઠિતો હોય તો ગોળી લઈ શકો છો. આ માટે તમારા ડૉક્ટર કે નર્સ બેનની સલાહ અવશ્ય લેવી. જે તમને ડાયાબીટીસ કે વાઇ (ખેંચ) નું દર્દ હોય તો તમારે વધુ માત્રાવાળી ગોળીની જરૂર પડશો. પણ તે બાબત ડૉક્ટરનો મત જરૂર લેવો. ગોળી લેતાં પહેલાં અને તે સમય દરમ્યાન તમારું લોહીનું દબાણ જરૂર ચેક કરાવો. ખાસ કરીને જે તમને અકારણ માથું દુઃખાંહું હોય, તમારું વજન વધુ હોય, આંખે અંધારા આવતા હોય, ડાબા ખબે કે છાતીમાં દુઃખાવો, વારંવાર ચક્કર આવતા હોય તો તમારું રક્તદાખ (બ્લડ પ્રેશર) ચકાસવું જોઈએ.

મિશ્રાયવાળી ગોળીની આડઅસરો :

અનિયમિત માસિક : માસિક ચક નાનું બનવું, ઓછું માસિક (લોહી) આવવું, કોઈ કોઈ વાર માસિક આવે જ નહિ કે અવારનવાર માસિકના ટીપા પડે તેવી આડઅસરો જેવા મળે છે. આ બધાને કારણે જે તમને સામાજિક કે માનસિક તકલીફ થતી હોય તો તે બાબત તમારે તમારા નર્સ બેનને ડૉક્ટરને જણાવવું જોઈએ. કોઈ વાર ગોળી બદલવાથી આડઅસર ઓછી થાય તેવું પણ બને.

ઉલ્ટી-ઉભકા થવા : ગોળી લેવાની શડુ કરો ત્યારે બે-ત્રણ માસ આવું રહે છે અને પછી તે બંધ થઈ જય છે. આવું થાય ત્યારે ગોળી લેવાનો સમય વધુ નિયમિત રાખો અને જરૂર પડે તેમાં ફેરફાર કરવો. જેમ કે દરરોજ સવારે ગોળી લેતા હો તો તેને બદલે દરરોજ રાત્રે જમવાની સાથે/પછી ગોળી લેવી. ઘણી સ્ત્રીઓને રાત્રે ગોળી લેવાથી વધુ સારું લાગે છે.

કુટુંબ નિયોજન

માથું દુઃખવું : શક્તાત્ત્વના થોડા મહિના સાધારણ માથું દુઃખવું તે સામાન્ય રીતે જેવા મળે છે. પરંતુ જે માથું ખૂબ દુઃખે કે તેની સાથે દાખિ ધૂંઘળી બને તો આ એક ગંભીર બાબત છે. ડૉક્ટરની સલાહ જરૂર લેવી. ધાવણ ઓછું થવું : જે બેનો બાળકને પોતાનું દૂધ આપે છે તેઓ આ ગોળીઓ લેશે તો તેમનું દૂધ ઓછું થાય છે. માટે નાના બાળકવાળી બેનોએ આ ગોળીઓ ના લેવી અથવા બાળક પૂરક આહાર લેતું થાય તે પછી જ આ ગોળીનો ઉપયોગ શક્ત કરવો જેઠાં એ. ત્યાં સુધી ગર્ભનિરોધ માટે આડશા/અવરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો જેઠાં એ.

કોઈપણ નવી દવા લેતાં પહેલાં તમારા ડૉક્ટરને તમે ગર્ભનિરોધક ગોળી લો છો તે જરૂર જણાવો. કેટલીક દવાઓ (દા.ત. જીવાણુ વિરોધી દવાઓ) આ ગોળીની અસર ઓછી કરે છે. તેથી ડૉક્ટર તે દવાની સાથે અન્ય આડશાપદ્ધતિ વાપરવાની સલાહ આપશે.

ચેતવણી :

- * જે સખત માથું દુઃખે,
- * જે હાથ-પગમાં ખાલી ચરે,
- * જે હંદું ચઢવા લાગે,
- * જે ધૂંઘળું દેખાવા માંડે,
- * જે છાતીમાં સખત દુઃખે,
- * જે પગમાં સખત દુઃખાવો થાય,


તો તરત જ ગોળી બંધ કરવી. આવા લક્ષણોવાળી ખીને સગર્ભાવસ્થા આવે તો પણ અત્યંત નુકસાનકારક થાય. તેથી કોઈપણ નિરોધક પદ્ધતિ વાપરો અને આરોગ્યકેન્દ્રની મુલાકાત લો.

ગોળી કેવી રીતે લેશો ?


ગમે તે પ્રકારની ગોળી હોય પરંતુ માસિકના પ્રથમ દિવસે જ તે શક્ત કરવી હિતાવહ છે. જે કે માસિકના સાત દિવસોમાંથી ગમે તે દિવસથી તમે શક્તાત્ત્વ કરી શકો છો. દરરોજ ગોળી લેવાનું ચાલુ કર્યા છતાં પ્રથમ બે અઠવાડિયા સુધી બીજી કોઈ નિરોધક પદ્ધતિ પણ વાપરો અથવા સમાગમ ના કરો, કારણ કે આ સમય દરમ્યાન ગર્ભ રહી શકે છે. જે દિવસે સમાગમ ન કર્યો હોય તે દિવસે પણ ગોળી લેવાનું ચાલુ જ રાખવું પડે છે. વળી ગોળી દરરોજ નક્કી કરેલા સમયે જ લેવાથી આડઅસરો ઓછી આવે છે.

જે તમે ૨૮ ગોળી વાળું પડીકું વાપરતા હો તો દરરોજ એક-એક સફેદ ગોળી માસિકના પ્રથમ દિવસથી શક્ત કરવી. ૨૧ ગોળી પૂરી થયા બાદ એવી જ રીતે લાલ ગોળી પણ એક-એક લઈ પૂરી કરવી. ત્યાર બાદ ફરી બીજું પડીકું શક્ત કરી દેવું. લાલ ગોળી લો છો તે દરમ્યાન માસિક આવી જશે.

જે તમે ૨૧ ગોળીવાળું પડીકું વાપરો છો તો માસિકથી શક્ત કરી ૨૧ દિવસ સુધી દરરોજ એક ગોળી લો અને ત્યાર બાદ બરાબર ૭ દિવસ ગોળી લેવાનું બંધ કરો. ફરી બીજું પડીકું શક્ત કરો. ગોળી બંધ હશે તે દરમ્યાન માસિક આવી જશે.



૨૮ ગોળીવાળી પડી



૨૧ ગોળીવાળી પડી

ગોળી લેવાનું ભૂલી જાઓ ત્યારે :

જે તમે ગોળી લેવાનું ભૂલશો તો ગર્ભ રહી જવાની શક્યતા પૂરી છે. જે એક ગોળી ભૂલી જવ તો જ્યારે યાદ આવે ત્યારે તે લઈ લો. કદાચ એવું પણ બને કે તમે બીજે દિવસે બે ગોળી સામટી લેશો. ત્યાર બાદ એક એક કરી દરરોજ લેવાનું ચાલુ રાખો.

જે સંંગ બે દિવસ સુધી ગોળી ભૂલી જાઓ તો પછીના બે દિવસ સુધી બે-બે ગોળી લેવી અને ત્યાર બાદ એક એક કરીને પડીકું પૂરું કરો. જે દિવસે ગોળી લેતાં ભૂલી ગયા તે દિવસે સમાગમમાં નિરોધ વાપરવો જોઈએ.

પરંતુ જે ત્રણ કે તેથી વધુ દિવસ માટે ગોળી લેવાનું ભૂલી જવ તો આ ચક માટે ગોળી ના લેશો. ગર્ભ નિરોધ માટે બીજી કોઈ પદ્ધતિ વાપરો. શક્ય છે કે તે બંધ થવાથી વહેલું માસિક આવી જય ! ચિંતા કરશો નહિ. નવા ચકમાં ફરી નિયમિત ગોળી ચાલુ કરી દો.

જે કોઈ પણ કારણસર પ્રયત્ન કરવા છિતાં તમે અવાર નવાર ગોળી લેવાનું ભૂલી જ જતાં હો તો અન્ય પદ્ધતિ વાપરવી વધુ સારી.

જે તમે બાળક ઈચ્છિતા હોવ તો છેલ્લું પડીકું પૂરું કરીને ગોળી બંધ કરી દો. મોટા ભાગે તરત જ તે વર્ષમાં જ તમને ગર્ભ રહી જશે.

મિશ્રણવાળી ગોળીઓ લેવાના ફાયદા :

1. પાંદુ રોગ અટકાવી શકે કારણ છેલ્લી ૭ ગોળીઓ લોહતત્ત્વની હોય છે.
2. છાતી-સ્તનમાં ગાંઠ થતી નથી.
3. અંદાશયનું અને ગર્ભશયની આંતરત્વચાના કેન્સરનું જોખમ ૩૦%-૪૦% જેટલું ઓછું થાય છે.
4. માસિકને આગળ-પાછળ લાવી શકે છે.
5. ૫-૧૦ વર્ષ ગોળી લેવાથી હાડકાનું પોતાણ અને હૃદયની બિમારી ઓછી થાય છે.
6. માસિક નિયમિત થાય છે અને દુઃખાવો ઓછો/સાધારણ જ થાય છે.
7. વધારે પછું કે અનિયમિત માસિક આવતું હોય ત્યારે આ ગોળી માસિક નિયમન માટે પણ વાપરી શક્ય છે.
8. નવા સંશોધન પ્રમાણે આ ગોળી સતત ત્રણ કે છ મહિના સુધી લઈ શકાય છે અને એનો ફાયદો એ કે, માસિક પણ ત્રણ કે છ મહિને જ ગોળી બંધ કર્યા પછી આવશે.
૯. એન્ડોમેટ્રીઓસીસનું જોખમ ઘટે છે.



કુટુંબ નિયોજન

મિની પીલ : ફક્ત પ્રોજેસ્ટીન વાળી મિની-પીલ લેવાથી પણ ગર્ભનિરોધ કરી શકાય છે. આ ગોળી પણ ઉપર જણાવ્યા મુજબ મિશ્રણવાળી ગોળીની જેમ જ લેવાની હોય છે.


આ ગોળીનો વધારાનો ફાયદો એટલો છે કે,

- * ધાવણ આપતી માતાઓ તે વાપરી શકે છે.
- * મિશ્રણ ગોળીથી આડઅસર આવતી હોય તે સ્ત્રીઓને આ ગોળી કામ આવે છે.

આડઅસર : અનિયમિત માસિક કે અવારનવાર માસિકના ટ્પકાં પડવાં અથવા માસિક બંધ થઈ જવું તે તેની સામાન્ય અસરો છે. આરોગ્યકેન્દ્રની સલાહ મુજબ તમે આ ગોળી વાપરવાનું ચાલુ રાખો. તેનાથી માથું દુઃખવાની ફરિયાદ પણ ઘણી સ્ત્રીઓને થાય છે. તે શરૂઆતમાં બે-ત્રણ માસ રહેશે પછી તેનાથી તમે ટેવાઈ જશો. આ સમય દરમિયાન જરૂર પડે તો સાથે પેરાસિટામોલની ગોળી માથાનો દુઃખવો ઓછો કરવા લેવી.

પ.૨ આરોપણ કેપ્સ્યુલ (ઇલ્પાન્ટ) :

ફક્ત પ્રોજેસ્ટીન વાળી ગોળીની માફક ચામડી નીચે મૂકવાની કેપ્સ્યુલ બનાવવામાં આવી છે. પ્રોજેસ્ટીન હોર્મોન વાળી આ કેપ્સ્યુલ સ્ત્રીના બાવડાની ચામડીની નીચે શક્રક્રિયાથી આરોપી દેવાય છે. અત્યાર સુધી છ કેપ્સ્યુલ બાવડામાં મૂકવામાં આવતી હતી હવે બે કેપ્સ્યુલની બનાવટ પણ આવી ગઈ છે. તેથી આગળ એક કેપ્સ્યુલથી જ કામ ચાલી જય તે માટેના પ્રયોગો ચાલે છે. અત્યારે આ આરોપણ કેપ્સ્યુલો નોર પ્લાન્ટના નામે બજરમાં મળે છે. તેનાથી સ્ત્રીને પાંચ વર્ષ સુધી ગર્ભ રહેતો નથી. પાંચ વર્ષ પછી ફરી શક્રક્રિયાથી ખાલી કેપ્સ્યુલો કઢાવવાની હોય છે. જરૂર પડે ગમે ત્યારે વચ્ચે પણ તમે સર્જન પાસે જઈ તે કઢાવી શકો છો.



તાતીમ પામેલા સર્જન કે નર્સ બાવડાની ચામડીમાં નાનો ચીરો મૂકીને નોર પ્લાન્ટ મૂકે કે કાઢે છે. આ કામ કુટુંબનિયોજન કેન્દ્રમાં કે દ્વારાનાના ઓપરેશન થીએટરમાં જ કરવામાં આવે છે.



ચાદ રાખો : નિષણાત અને ખાસ તાતીમ પામેલા સર્જન પાસે જ આ સાધન કઢાવવું પડે છે. તેને બાવડામાં મૂકવા કરતાં કઢાવાનું ખૂબ અધું છે. વળી આપણે ત્યાં આ સાધન પ્રયોગકર્પે સરકારી કાર્યક્રમમાં મૂકવામાં આવે છે. પરંતુ તે ઘણું મોદું છે. તેથી તમને આડઅસરો થાય તો પણ સરકારી ડૉક્ટરો તેને કાઢી આપવા ખાસ તૈયારી દર્શાવતા નથી.

માટે આ સાધન લગાવતા પહેલાં પૂરતો વિચાર કરી લેવો. જે નજીકના ભવિષ્યમાં તમારે બાળક જોઈતું હોય તો આ સાધન ના વાપરવું અગાઉ જણાવ્યા મુજબ મિત્ર રસાયણ ગોળીની માફિક જે કોઈપણ તકલીફ તમને હોય તો આ સાધન વાપરવું નહીં. જે તમે વાની દવા લેતા હો તો આ સાધનની અસર ધીમી પડે છે. તેથી તમારે તેની સાથે નિરોધ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.

સામાન્ય આડઅસરો :

શરૂઆતના એક-બે માસ સુધી માસિક ચક અનિયમિત બને કે માસિક આવવાનું તદ્દન બંધ થઈ જય તો ગબરાવું નહીં. કેટલીક બેનોને ટ્યુકે-ટ્યુકે દરરોજ લોહી પડવાની ફરિયાદ પણ શરૂ થઈ જય છે. તમારા શરીરને અગાઉ કરતાં વધુ પ્રોજેસ્ટીન મળી રહ્યું છે તેથી આ આડઅસર થાય છે. પણ તે ધીમે ધીમે મટી જય છે. કોઈને તેનાથી વધુ હેરાનગતિ થતી હોય તો ઓછી માત્રામાં બંન્ને હોર્મોન હોય તેવી ગોળી થોડાક માસ સુધી લઈ શકાય. કેટલીક બેનોને આ સાધનથી માથું દુઃખ્યા કરે છે. આ બેનોને આઈબુપ્રોફેન કે એસ્પ્રેસીનની ગોળી લેવાથી રાહત મળે છે.

હોર્મોનવાળા આરોપણ કેપ્સ્યુલ કે ઇમ્પ્લાન્ટ આપણા દેશમાં સામાન્યપણે વપરાતા નથી કારણકે, તેથી ઘણા ગેરફાયદા છે, જેમ કે,

- * તે નિષ્ણાત પાસે જ મૂકાવી કે કઢાવી શકાય છે.
- * લગભગ દરેક સ્ત્રીને માસિક અનિયમિત થાય છે. માસિક બંધ કે ઓછું થાય, દરરોજ આવે, દીપે દીપે ચાલુ રહે અથવા ઘણું વધારે આવે. દરેકમાં સ્ત્રીઓને સમસ્યા થતી હોય છે.
- * તેની આડઅસરો ઘણી છે અને બીજી દવાઓ સાથે વિપરીત અસરવાળી છે.
- * તે પરદેશથી આવે છે માટે ખૂબ મૌંધાં છે.

પ.૩ ગર્ભનિરોધક ઈંજેક્શન (પ્રોજેસ્ટીન ઈંજેક્શન) : દર એક થી ત્રણ માસે સ્ત્રી આ ઈંજેક્શન લેશો તો તેને ગર્ભ રહેતો નથી. ફક્ત પ્રોજેસ્ટીનવાળા આ ઈંજેક્શન સ્ત્રી તેના પતિને કે અન્ય કોઈને જણાવ્યા વગર જ ઉપયોગ કરી શકે છે. તે ડેપો પ્રોવેરા કે નોરટિસ્ટ્રેટ નામે વેચાય છે. જે સ્ત્રીઓને આગળ વાળવેલ તકલીફ (એટલે કે, સગર્ભાવસ્થા, ડાયાબીટીસ, લોહીનું ઊંચું દબાણ, લોહીમાં ગઢા થવા, કલેન્ઝમાં નુકસાન હોય કે કેન્સર થયું હોય) હોય તેઓએ આ ઈંજેક્શન ના લેવું. જે સ્ત્રીઓને એકાદ વર્ષમાં ગર્ભાધાનની ઈરછા હોય તેમણે પણ આ ઈંજેક્શન ના લેવું.

સામાન્ય આડઅસરો : ઈંજેક્શન દ્વારા પ્રોજેસ્ટીનની ઘણી માત્રા એક સામટી આપવાની હોય છે તેથી ઘણી સ્ત્રીઓનું માસિક ચક અનિયમિત થઈ જય છે. થોડાક માસમાં જ આ ઠીક થઈ જય છે. આ સિવાય આ ઈંજેક્શન લેતી બહેનોને વચ્ચે વચ્ચે કે દરરોજ થોડુંક માસિક લોહી પડે છે. કયાં તો કોઈકને ખૂબ ભારે રક્તસ્ત્રાવ પણ થાય છે. તેથી તેને નિયમિત બનાવવા બે માસ સુધી આરોગ્ય રક્ષક

કુટુંબ નિયોજન

પાસેથી બંને હોર્મોન વાળી (માલા-ડી, વગેરે) ગોળી બે માસ સુધી લેવાથી જરૂર ફાયદો થાય છે.

બન્ને હોર્મોનવાળા ઈંજેક્શન પણ હોય છે. તે આનાથી ઘણાં ખર્ચાળ હોવાથી આપણે ત્યાં કોઈ વાપરતું નથી. તે સહેલાઈથી મળતાં પણ નથી.



કેવી રીતે વાપરશો : ઈંજેક્શનના પ્રકાર પ્રમાણે તેને નિયમિત લેવા જેઠાં એ. માસિક પછી પાંચ દિવસ દરમ્યાન તે લીધું હોય તો તરત ૭ તેની અસર શરૂ થઈ જાય છે. પણ જે તે માસિકના ૬ કે તેથી વધુ દિવસ બાદ લીધેલું હોય તો પંદર દિવસ સુધી નિરોધ વાપરવું હિતાવહ છે. ડૉક્ટરની સલાહ વગર આ લેવું નહિ.

આપણા દેશમાં આ ઈંજેક્શનો અંગે ખૂબ વિવાદ ચાલે છે. સ્ત્રી સંગઠનોએ આ ઈંજેક્શનોનો કાયદાકીય રીતે પણ વિરોધ કરેલો છે. ભારતીય સ્ત્રીઓ પર થયેલા પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે તેનાથી અનેક ગ્રકારની આડઅસરો થાય છે. અનિયમિત માસિકથી માંડીને કાયમી માથું દુઃખવું કે હતાશા રોગ પણ તેનાથી થઈ શકે છે. ભારતમાં તેપો પ્રોવેરા ૧૯૮૪ થી શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી રાહે બજારમાં જરૂર મળે છે. બજારમાં મૂકાયા બાદ થયેલા કેટલાક અભ્યાસોના તારણમાં જાણવા મળ્યું છે કે તે વાપરવાથી ઓછું માસિક કે માસિક બંધ થઈ જાય તેની બહુ ફિકર સ્ત્રીઓ કરતી નથી અને તેનો વપરાશ ચાલુ રાખે છે. એમ જેવામાં આવ્યું છે કે ઈંજેક્શન લેવાનું બંધ કર્યો બાદ કેટલીક બેનોને ગર્ભ રહેતાં વાર લાગે છે કે માસિક ફરી નિયમિત બનતું નથી. છતાં અત્યારે તો આ ઈંજેક્શન ગર્ભનિરોધ માટે ઘણું પ્રચલિત બની રહ્યું છે. ખાસ કરીને નિયમિત રીતે તબીબી સેવાઓ મેળવી શકતી બેનો આ પદ્ધતિ વધુ વાપરે છે.



ઠંજેકશન લેવાનું બંધ કર્યાના એકાદ વર્ષ સુધી તમે માતા નહીં બની શકો કે તમારું માસિક નિયમિત નહીં થાય. કોઈ કોઈ બેનોને માસિક તરત પણ નિયમિત થઈ જય છે. માટે ઠંજેકશન બંધ કરો અને બાળક ના જેઠિતું હોય તો બીજું સાધન વાપરવાનું ચાલુ રાખો.

૬.૦ ગર્ભાશયમાં મૂકવાના સાધનો : (આંકડી કે કોપર ટી) :

ગર્ભાશયમાં મૂકવાની કોપર ટી અત્યાર સુધી આપણે ત્યાં ત્રણ વર્ષે કાઢી નાંખવાની હોય તે જ મળતી હતી. આ કોપર ટી જરૂર પડ્યે બીજી મૂકાવી શકાય છે. પરંતુ ત્રીજી મૂકાવતાં પહેલાં બે-ત્રણ વર્ષનો ગાળો રાખો અને બીજી સાધનો વાપરો. કદાચ હવે પછી તમારે બાળક ના જ જેઠિતું હોય તો ઓપરેશન પણ કરાવી લેવાય. હવે તો ૧૦ વર્ષ ચાલે તેવી કોપર ટી પણ મળવામાંડી છે. તેથી લાંબો સમય ગર્ભનિરોધક વાપરવાનું હોય તો તમે એ પણ મૂકાવી શકો છો. ગર્ભાશયમાં રહેલી કોપર ટીને કારણે શુફાણુ અને સ્ક્રીબીજનું ફલિની કરણ થતું નથી અને ગર્ભાધાનની શક્યતા રહેતી નથી. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે પુરુષને ખબર પણ નથી પડતી અને સ્ક્રી ગર્ભાધાન રોકી શકે છે.



ગર્ભાશયમાં મૂકેલ કોપર ટીના છેદે લાગેલ બે દોરા સ્ક્રીની યોનિમાં લટકતા હોય છે. ક્યારેક પુરુષને સમાગમ વખતે તેની જણ થઈ શકે છે. અગાઉ આ સાધનો તાંબા જેવી ઘાતુના બનતા હતા. હવે તે પ્લાસ્ટીકના પણ બને છે અથવા પ્લાસ્ટીક અને તાંબુ બંને વાપરીને પણ તે બને છે.

કેટલાક દેશોમાં પ્રોજેસ્ટીનવાળી આંકડી મળે છે. જેમાંથી નીકળતા પ્રોજેસ્ટીનને કારણે ગર્ભ રહેતો નથી અને દુઃખાવો કે વધારે પડતા માસિકની ફરિયાદ ઓછી થઈ જય છે. તેનાથી પાંચ વર્ષ સુધી ગર્ભાધાન થતું નથી.

યાદ રાખો : આ સાધનથી જતીય રોગ કે એચાઈવી સામે રક્ષણ મળતું નથી. જે કોઈ સ્ક્રીને આ સાધનના ઉપયોગ દરમ્યાન જતીયરોગ કે અન્ય ચેપ લાગે છે તો તે બહુ જલ્દીથી તેના ગર્ભાશયમાં અને પેઢુમાં પણ ફેલાઈ જય છે. તેથી આ સાધન વાપરો ત્યારે બીજ કોઈ પણ ચેપ ના લાગે તેની ખાસ કાળજી લો. આ સાધનના વપરાશ દરમ્યાન માસિક સ્વચ્છતા જળવવી ખાસ જરૂરી છે. માસિકના કપડાં ચોખ્ખા અને મુલાયમ હોવા જેઠિએ. દરરોજ નિયમિત તે બદલી નાંખવાં. ધોઈને તહે સૂકવેલાં કપડા જ વાપરવા જેઠિએ.

કુટુંબ નિયોજન



આઇઅસર : માસિક ખ્રાવમાં વધારો તેની સામાન્ય આઇઅસર છે. કેટલીક સ્ત્રીઓને વધુ દિવસ વધુ પ્રમાણમાં અને વધુ દ્રુતભાવા સાથે માસિક આવે છે. તે માટે લોહિતત્ત્વની ગોળી ચાલુ રાખવી પડે છે. જરૂર પડ્યે ડૉક્ટરની મુલાકાત પણ લેવી કેટલીક બેનોને ખૂબ વધારે લોહી પડે તો કોપર ટી કાઢી લેવી પડે છે.

જે તમે સગર્ભા હો કે તમને જાતીય રોગ કે ચેપ થયેલો હોય, ભૂતકાળમાં ટ્યૂબમાં ગર્ભાધાન થયેલ હોય, ક્યારેય સગર્ભા ન બન્યા હો, કે ખૂબ વધારે પ્રમાણમાં માસિક આવતું હોય તો કોપર ટી મૂકાવવી જેઠાં નહિ.



આ સાધન ખાસ તાલીમ લીધેલ નર્સ બેનો કે ડૉક્ટર પાસે મૂકાવવું જેઠાં નહિ. માસિકના પાંચ દિવસ દરમ્યાન સાધન મૂકાવવાથી તમે સગર્ભા નથી તેની ખાતરી રહે છે.

કોઈક વાર કોપર ટી બહાર નીકળી જય છે અને સ્ત્રીને તેની જણ રહેતી નથી. તો તે સ્ત્રી સગર્ભા બની શકે છે. માટે દરરોજ દિવસમાં એકાદ્વાર અથવા માસિક પછી તરત આંકડી નીકળી નથી ગઈ તેની ખાતરી કરી લો. આ માટે ઉભા પગે બેસીને તમારા હાથની બે આંગળીઓ બરાબર ધોઈને તમારી યોનિમાં તપાસ કરો કે કોપર ટીના દોરા છે કે નહિ.

કોપર ટી જેવા ગર્ભાશયના સાધનોની સમસ્યાઓ :

પેદુમાં ચેપ થવો તેની સૌથી સામાન્ય સમસ્યા છે. મોટા ભાગે સ્ત્રીને કોપર ટી મૂકતાં પહેલાંનો ચેપ હોય તો તે શરૂઆતના બે-ત્રણ માસમાં હેખા હે છે. અથવા જે તે મૂકતી વખતે બરાબર ચોખ્ખાઈ ના રાખી હોય તો આવું થાય છે. જે તમને

- * માસિક મોડું-મોડું આવવા લાગે.
- * નીચેના પેદુમાં સખત દુખાવો થાય કે સમાગમ વખતે ખૂબ દ્રુતભાવાં.
- * યોનિમાંથી ખરાબ વાસવાળું પ્રવાહી નીકલ્યા કરે.



- * તાવ કે ધુનારી થાય. બેચેની લાગે.
- * તેના દોરા ખૂબ ઢૂંકા કે લાંબા હોય કે બિલ્કુલ હોય જ નહિ.
- * સમાગમ વખતે તમારા પતિને આ સાધન અડકતું હોય એમ લાગે તો,
તાત્કાલિક દવાખાને કે કુટુંબનિયોજન કેન્દ્ર પર જઈ યોગ્ય નિદાન/સારવાર કરાવો.

કોપર ટી કઢાવવી :

તાલીમ પામેતા નર્સ કે ડૉક્ટર પાસે જ આ કામ કરાવવું. જે તે મૂક્યા પછી તરત તમે સરળ્યા છો તેવો તમને ઘ્યાલ આવે તો પણ તે તરત કાઢી નાંખવો. આપણા દેશમાં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમમાં કેમ્પ દ્વારા ધણા ઊંડાણના ગામોની બેનોને પણ કોપર ટી મૂકી આપવામાં આવે છે. એકવાર તે મૂક્યા પછી બેનોને કોઈ તકલીફ થાય તો તે માટેનું યોગ્ય માળખું ગ્રામ્ય વિસ્તારમાં નથી. તેથી ગર્ભનિરોધ માટે આ એક સારું સાધન હોવા છતાં તેનો ઉપયોગ બરાબર થતો નથી. અંત:ખાવી પદ્ધતિઓની સરખામણીમાં આ સાધન વધુ સારું છે કારણકે શરીરની સામાન્ય પ્રક્રિયાઓમાં તેનાથી ડખલ થતી નથી. છતાં યોગ્ય તબીબી માળખું ના હોય તેવી જગ્યાઓએ કોપર ટી મૂકતાં/મૂકાવતાં પહેલા ખૂબ વિચાર કરવો જેઠાએ.

૭.૦ કુટુંબનિયોજન માટે કુદરતી પદ્ધતિઓ :

ઉપરોક્ત સિવાય બીજી ત્રણ પદ્ધતિઓ છે જેમાં કોઈ સાધન કે દવાની જરૂર નથી.

- * પ્રથમ છ માસ સુધી ધાવણ આપવું.
- * ભ્યુક્સ (પ્રવાહી) પદ્ધતિ
- * રીધમ પદ્ધતિ


બાળજન્મ પછી પ્રથમ છ માસ સુધી જે તમે નિયમિત ધાવણ આપતા હશો તો મોટેભાગે આ સમય દરમ્યાન માસિક બંધ રહે છે અને તમને ગર્ભ રહેવાનો નથી. છતાં આ બાબતે ચોક્કસ ખાતરી આપી શકતી નથી. કેટલીકવાર સૂવાવડ પછી ધાવણ આપતી માતાને એક પણ માસિક ન આવ્યું હોય છતાં ગર્ભ રહી ગયો હોય તેવું જેવા મળે છે. તેથી બાળક ન થાય તે માટે નિરોધ જેવું ગર્ભ નિરોધક વાપરવું હિતાવહ છે.




કુટુંબ નિયોજન

ધ્યાન રાખો કે,

1. તમારું બાળક છ માસથી નાનું છે.



2. બાળજન્મ પછી એકાદવાર પણ તમને માસિક નથી આવ્યું.



3. તમારા બાળકને નિયમિત તે જ્યારે માંગે ત્યારે ધાવણ આપો છો. બે ધાવણની વચ્ચે છ કલાકથી વધુ ગાળો ના પડવો જોઈએ.

4. રત્ને પણ બાળક ધાવણ લેતું હોય કે છ કલાકના સમયગાળા દરમ્યાન એક પણ વાર છાતીમાંથી દૂધ કાઢવાનું ના બની શક્યું હોય તો તમે તે દિવસે સમાગમમાં નિરોધ જરૂર વાપરો



પ્રવાહી પદ્ધતિ માટે માસિક ચક અંગે જગૃતિ :

કુદરતી રીતો વાપરતાં પહેલાં તમને તમારા માસિકચક અંગે પૂરી જગૃતિ હોવી જોઈએ. માસિકચકના કયા દિવસોમાં ગર્ભાધાન થઈ શકે છે તેની માહિતી તમને હોવી તેને આપણે ગર્ભાધાન-જગૃતિ કહીશું. આ સમયગાળા દરમિયાન તમારે સમાગમ ન કરવો કે સમાગમમાં નિરોધ વાપરવો. આનું બરાબર ધ્યાન રાખવાથી તમે સગર્ભા નહીં બનો.


આ પદ્ધતિઓ વાપરવા માટે કોઈ કિંમત ચૂકવવાની નથી. તેની કોઈ આડઅસરો નથી, તેથી તે પદ્ધતિઓ શ્રેષ્ઠ છે એમ કહી શકાય. છતાં આ પદ્ધતિઓ સફળતાપૂર્વક વાપરી શકાય તે માટે પતિ-પત્ની વચ્ચે ખાસ સમજણ કેળવવી જરૂરી છે. આરોગ્યકાર્યકર પાસે નિયમિત જઈને તમારા માસિકચકના કયા દિવસોમાં ગર્ભાધાન થઈ શકે તે જાણવાની તાલીમ લો. આ પદ્ધતિ બરાબર શીખતાં ત્રણથી ચાર માસ લાગે છે.

ગર્ભાધાન જગૃતિ : દરેક સ્ત્રીના શરીરમાં

- * દર માસે એક સ્ત્રીબીજ પરિપક્વ થઈ છૂટું પડે છે.
- * માસિકના ૧૪ મા દિવસે બીજ બીજશયમાંથી બહાર આવે છે.
- * સ્ત્રીબીજનું જીવન ૨૪ કલાકનું હોય છે.
- * સ્ત્રીના શરીરમાં દાખલ થયા બાદ શુક્કાળું બે દિવસ (૪૮ કલાક) જીવે છે.

તેથી બધુ મળીને સ્વીભીજ છૂટું પડવાના ત્રણ દિવસ અગાઉ અને છૂટું પડ્યા પછીના ત્રણ દિવસ એમ કુલ મળી સાત દિવસ સમાગમ ના કરો કે નિરોધ વાપરો તો ગર્ભાધાન થતું નથી. એટલે કે બાળક ના જેઠિતું હોય તો માસિકના ૧૧ થી ૧૭ મા દિવસ સુધી સમાગમ ના કરો કે નિરોધ વાપરો. ખરેખર તો ૧૭ મા દિવસ પછી માસિક આવે ત્યાં સુધીનો ગાળો સલામત ગાળો કહેવાય છે. ત્યારે ગર્ભાધાન થતું નથી.



આ જણાકારીની સાથે પ્રવાહી પદ્ધતિ અને રીધમ પદ્ધતિ દ્વારા પણ તમારા શરીર અંગો તમને વધુ માહિતી મળશે અને તમે ગર્ભાધાન અંગો વધુ જગૃત થઈ શકશો.



મ્યુક્સ (પ્રવાહી) પદ્ધતિ :

દેરેક સ્વીના યોનિમાર્ગમાંથી ઝરતા પ્રવાહીમાં માસિકચક દરમિયાન ચોક્કસ ફેરફાર આવે છે. જે તમે દરરોજ આ પ્રવાહી તપાસશો તો તમને આ અંગો ચોક્કસ માહિતી જરૂર મળશે.

૧. યોનિની આજુબાજુનું પ્રવાહી આંગળી કે કપડાંથી સાફ કરી નાંખો.
૨. જે ત્યાં કોઈ પ્રવાહી હોય તો તે આંગળી પર લઈને બે આંગળીથી જુઓ કે તે કેવું છે. તે જે ભીનું, પારદર્શક અને લીસું હોય તો અત્યારે તમને ગર્ભ રહી શકે છે. જે તે સફેદરંગનું હોય, સૂકું હોય કે આંગળી પર ચોટી જતું હોય તો જાળો કે હાલ ગર્ભાધાન થશે નહિ.




આરપાર દેખાય તેવું ભીનાશવાળું
ને ચીકણું પ્રવાહી = ગર્ભાધાન થશે.

સફેદ, સૂકું કે આંગળી વચ્ચે તાર ન નીકળી
શકે તેવું પ્રવાહી = ગર્ભાધાન નહીં થાય.

કુટુંબ નિયોજન

3. જે દિવસોએ પારદર્શક, ભીનું અને લીસું પ્રવાહી આવે તે દિવસોએ અને તે આવવાનું અઠકી જય તે પછીના ચારદિવસ સુધી સમાગમમાં નિરોધ વાપરો અથવા સમાગમ ટાળો. કોઈ પણ પ્રકારના શુક્કાણુનાશક રસાયણો ના વાપરશો.
4. જે તમને યોનિમાં ચેપ હશે તો પ્રવાહી ઓળખવામાં મુશ્કેતી પડશે. આવા સમયે બીજું સાધન વાપરો.
રીધમ પદ્ધતિ : નિયમિત માસિકચક હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકાય છે. છ માસ સુધી તમારા માસિકચકનું ધ્યાન રાખો. માસિકના પ્રથમ દિવસથી બીજી વારના માસિકના પ્રથમ દિવસ સુધી કેટલા દિવસ જય છે તે નોંધો. છ માસમાંથી સૌથી દુંકું ચક અને સૌથી લાંબું ચક કેટલા દિવસનું હતું તે શોધો. સૌથી દુંકા ચકના દિવસોમાંથી ૨૦ બાદ કરો અને સૌથી લાંબા ચકના દિવસોમાંથી ૧૦ બાદ કરો. સામાન્ય રીતે તમને આ બે દિવસોની વચ્ચેના દિવસોમાં ગર્ભાધાન થઈ શકે છે.

ઉદાહરણ : અમરાપુરના જેલીબેને છ માસ સુધી ઉપર પ્રમાણે ધ્યાન રાખતાં તેમનું દુંકું ચક ૨૬ દિવસનું છે અને લાંબું ચક ૩૪ દિવસનું છે તેમ જણાયું. માટે :



માટે, તેમને માસિકના ૬ છઢા દિવસથી ૨૪ મા દિવસ સુધી ગર્ભાધાન રહી શકે છે એમ કહેવાય. માટે આ સમય વખતે તેમણે સમાગમમાં નિરોધ વાપરવાની જરૂર પડશે. આમ તો ગર્ભાધાન થવાની સંભાવનાવાળા દિવસો પહેલાં કે પછીનો ગાળો સલામત ગાળો કહેવાય છે. છતાં વધુ સત્તામતી માટે ગર્ભાધાન થવાની સંભાવનાવાળા છેલ્લા દિવસથી માસિકના પહેલા દિવસ સુધી સમાગમ કરશો તો ગર્ભ રહેવાનો નથી.

કુટુંબનિયોજન માટે કુદરતી પદ્ધતિઓ

શરૂઆતના છ માસ જ્યારે તેઓ માસિકના દિવસો નોંધે છે ત્યારે પણ તેમણે બીજું સાધન વાપરવાની જરૂર છે. પરંતુ હોર્મોન (રાસાયણિક અંતઃખાવ) વાળા સાધન (ગોળી, ઈલેક્શન, વગેરે) વાપરવા નહીં. તેનાથી માસિક ચકની લંબાઈ પર સીધી અસર થાય છે. આ સમય દરમ્યાન તેમના માસિકની કુદરતી લંબાઈ જાળવી જરૂરી છે. તેથી જરૂર પડ્યે નિરોધ વાપરવા જોઈએ. માસિકને અસર કરે તેવી કોઈ જ રીતનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

કુદરતી પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે

1. ગર્ભધાન થવાની સંભાવનાવાળા દિવસો પૂરા થયા પછી અને પછીનું માસિક આવે તે વચ્ચેના દિવસોમાં સંભોગ કરવો.
2. મ્યુક્સ પદ્ધતિ અને રીધમ પદ્ધતિનો એક સાથે ઉપયોગ કરવો.
3. તમને ગર્ભધાન થવાના દિવસો અંગે ચોક્કસાઈ ન હોય તો તે દિવસે કયાં તો નિરોધનો ઉપયોગ કરવો કયાં તો સંભોગ કરવો નહિં.

ઉપરોક્ત કુદરતી સલામત ગાળાનું ધ્યાન રાખવું તે ગર્ભનિરોધ માટે શ્રેષ્ઠ રૂસ્તો હોવા છતાં તમને કેટલીક સમસ્યાઓ આવશે. જેમ કે, તમારા પતિ તમારા બિનસલામત ગાળા દરમ્યાન સમાગમ ન કરવા રાજ નથી, પતિ નશો કરેલા હોય ત્યારે તેમને તમારી વાત સમજતી નથી. તમે તેમને જોઈએ તેવો વિરોધ કરીને અથવા સમજલીને મક્કમતાથી ના નથી પાડી શકતા, સંસ્કારવશ તમે એમ માનો છો કે પતિ જ્યારે ઈચ્છે ત્યારે તેને શરીર સંબંધ કરવા દેવો તે દેરેક સ્વીની ફરજ છે, ધાર્મિક માન્યતાને કારણે તમે તમારા પતિને રોકી શકતા નથી. તમારા સંજોગો જ એવા છે કે પતિ-પતિનિ નક્કી દિવસોમાં મળી શકો તેવી સગવડતા નથી. તમારા પતિ સાથે ખાનગીમાં વાતચીત કરી શકો તેવી સગવડ તમારા ઘરમાં નથી વગેરે.....



આવા અનેક કારણોસર આપણા દેશમાં

કુદરતી પદ્ધતિઓ જોઈએ તેવું કામ આપતી નથી અને તમારે ના ઈચ્છિતા હોય છતાં સગર્ભાવસ્થા ચલાવી લેવી પડે છે.

કુટુંબ નિયોજન

૮.૦ ગર્ભનિરોધ માટે પારમ્પરિક કે ઘરેલું પદ્ધતિઓ :

દ્વારેક લોકસમુદ્દાયમાં ગર્ભ નિરોધ અંગેની કોઈને કોઈ પદ્ધતિઓ કે રિવાજે પ્રચલિત હોય છે. તમારા ગામભાડાં કે તમે કામ કરો છો તે સમાજમાં કઈ પદ્ધતિઓ પ્રચલિત છે તે જણો.

- * અસરકારક પદ્ધતિ : બાળજન્મ પછી સ્વીપુરૂષ અલગ રહે : કેટલાક સમાજેમાં બાળકના જન્મ પછી ધણા મહિનાઓ સુધી સ્વી-પુરૂષ અલગ રહે છે અને તેઓ સમાગમ કરતા નથી. આ એક સારી રીત છે. તેનાથી સ્વી નવા જન્મેલા બાળકનું બરાબર ધ્યાન રાખી શકે છે અને પોતાની તંદુરસ્તી પણ પાછી મેળવી શકે છે. એટલો સમય ગર્ભ રહેવાનો નથી એટલે એ પોતાનું અને બાળકનું ધ્યાન વધુ સારી રીતે રાખી શકે છે.
- * સમાગમ વખતે વીર્યસ્ત્રાવ પહેલાં શિક્ષ બહાર ખેંચી લેવું : આ પદ્ધતિમાં પુરુષે બરાબર ધ્યાન રાખીને શિક્ષને વીર્યસ્ત્રાવ પહેલાં જ કાઢીને જરા દૂર ખસી જવું પડે છે, જે હંમેશાં શક્ય બનતું નથી. કેટલાક પુરુષો આ રીત અપનાવે છે છતાં તે શિક્ષને ખેંચી લઈ ખસી જય તે અગાઉ કેટલુંક પ્રવાહી યોનિમાં જતું રહે છે. તેમાં શુકાણુ હોવાથી સ્વીને ગર્ભ રહી શકે છે. તેથી આ પદ્ધતિ ગર્ભનિરોધ માટે સારી/અસરકારક રીત નથી.

નુકસાનકારક કે બિનઅસરકારક પારમ્પરિક પદ્ધતિઓ :

- * જલ્દુ-ટોણાથી ગર્ભ નિરોધ કરી શકાય નહિ.
- * યોનિમાં ધાસ, પાંદડા, છાણ, પોટલી કે અન્ય વસ્તુ મૂકવાથી પ્રજનન માર્ગનો ચેપ થાય છે અને કાયમી નુકસાન થઈ શકે છે.
- * સમાગમ પછી યોનિને પાણી કે બીજી પાવડરોથી ધોઈ નાંખવા છતાં કેટલાક શુકાણુ ગર્ભાશયમાં દ્વારા થઈ જય છે અને ગર્ભ નિરોધ શક્ય બનતો નથી/ગર્ભ રહી જય છે.
- * સમાગમ પછી પેશાબ કરી આવવાથી ગર્ભનિરોધ નથી કરી શકતો. તેનાથી કદાચ પેશાબના માર્ગમાં કોઈ ચેપ લાગતો અટકાવી શકાય છે.



૯.૦ કાયમી ગર્ભનિરોધ માટે રીતો

નસબંધી :-


જ્યારે સ્વી-પુરૂષ બરાબર નક્કી કરી નાંખે કે તેઓને હવે બીજી બાળકોની જરૂર નથી ત્યારે તેઓએ નસબંધીનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. આ શાંકાંકિયા સાદી છે અને તેનાથી અન્ય કોઈ નુકસાન થતું નથી.

પુરુષ નસબંધી : આ શાસ્ત્રકિયાથી ગોટી(વૃષણ) માંથી શુકાણુ લઈ જતી નળીઓ કાપી અને બાંધી દેવામાં આવે છે. કોઈપણ આરોગ્યકેન્દ્રમાં તાતીમ પામેલા તબીબ આ ઓપરેશન કરી શકે છે. ચાદ રાખો કે તેમાં ગોટી (વૃષણ) કાપતા નથી માત્ર શુકાણુનિકા જ કાપવામાં કે બાંધવામાં આવે છે, સ્ત્રી નસબંધી કરતાં પણ આ શાસ્ત્રકિયા વધુ સરળ અને વધુ લાભદાયી છે. આ ઓપરેશનથી પુરુષની જતીય ઈરછા કે પ્રવૃત્તિ કોઈ રીતે બદલતી નથી. તે હજુ પણ પહેલાંની જેમ જ વીર્યસ્વાવ કરે છે પણ તેના વીર્યમાં હવે શુકાણુ હોતા નથી. આ શાસ્ત્રકિયા પછી ઓછામાં ઓછા ૨૦ વાર સમાગમ કરે ત્યાં સુધી પુરુષ નિરોધ વાપરે અથવા સ્ત્રી ગોળી લેવાનું ચાલુ રાખે તે ખાસ જરૂરી છે. આનાથી વીર્યમાં રહી ગયેલા તમામ શુકાણુ સાફ થઈ જય છે અને ગર્ભ રહેવાનો ઉર રહેતો નથી.



આવું ન કરવાથી સ્ત્રીને ગર્ભ રહી જય છે. ત્યારે સ્ત્રીને બદલન કે અન્ય પુરુષ સાથે સંબંધ છે એમ કહી તેને કૌટુંબિક ત્રાસ વેઠવો પડે છે. માટે પુરુષ નસબંધી પછી ૨૦-૨૫ વાર સમાગમ થાય ત્યાં સુધી દંપત્તિએ કાળજી રાખી ગર્ભ નિરોધની પદ્ધતિ ચાલુ રાખવી જોઈએ.

સ્ત્રીની બીજ લઈ જતી નળીઓ કાપી નાંખવામાં આવે છે.



સ્ત્રી નસબંધી : પુરુષની જેમ જ સ્ત્રી નસબંધી શાસ્ત્રકિયા થાય છે. અંડાશયમાંથી ગર્ભશયમાં દુંડું લઈ જતી બીજ નિકાઓ આ શાસ્ત્રકિયા દ્વારા કાપી અને બાંધવામાં આવે છે. પુરુષો કરતાં આ શાસ્ત્રકિયા થોડી અધરી છે. કારણ તેમાં સાચી નળી શોધીને ઓપરેશન કરવાનું હોય છે. આ શાસ્ત્રકિયાથી સ્ત્રી-પુરુષ પહેલાંની જેમ જ હજુ પણ જતીય આનંદ મેળવી શકે છે/સમાગમ કરી શકે છે. માત્ર દુંડા સુધી શુકાણુ પહોંચતાં નથી તેથી ગર્ભ રહેતો નથી. હવે સ્ત્રી નસબંધીનું ઓપરેશન દૂરભીનની મદદથી (લેપ્રોસ્કોપી પદ્ધતિ) થાય છે. આમાં એક જ ટાંકો લેવામાં આવે છે અને સ્ત્રી ઓપરેશનના ચાર કલાક પછી ઘરે જઈ શકે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત ઓપરેશન કરાવવાથી જતીય રોગ સામે રક્ષણ મળતું નથી તેથી જતીય રોગથી બચવા માટે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ.

૧૦.૦ તાત્કાલિક ગર્ભનિરોધની પદ્ધતિઓ :

ઘણી વાર સ્વીઓ સાધન વાપરતા ન હોય તેવાં સમયે અથવા સાધન વાપરવાનું ભૂલી જય ત્યારે આવી પદ્ધતિની ખાસ જરૂર પડે છે. કેટલીકવાર સમાગમ દરમ્યાન પુરુષનિરોધ વાપરતા હોય છતાં નિરોધ ફાઠી જય ત્યારે ગર્ભ રહી જવાનો ડર રહે છે. વળી જે સ્વી બળાત્કારનો બોગ બની હોય તેણે પણ ગર્ભ રહી જવાથી બચવું હોય તો તાત્કાલિક પદ્ધતિનો ઉપયોગ કરવો જેઠાંએ. સમાગમની તરત પછીથી આનો ઉપયોગ થાય તો તે વધુ અસરકારક બને છે. આ પદ્ધતિઓ સલામત અને અસરકારક છે જ, છતાં કાયમી વપરાશની જગ્યાએ તેનો વારંવારનો ઉપયોગ કરવાથી કેટલીક આહઅસરો થાય છે.

ગર્ભનિરોધક ગોળી : જે ગોળીઓ કાયમ લેવા માટે વપરાય છે તે જ ગોળીઓ વધુ માત્રામાં સમાગમ પછી લેવાથી ફિલિત ઢિંઢું ગર્ભશાયમાં સ્થાપિત થતું નથી. આ ગોળીઓ વધુ માત્રામાં સમાગમ બાદ ત દિવસની અંદર જ લેવામાં આવે તો જ તે સમાગમથી રહેનાર ગર્ભ નથી રહેતો. તેની અગાઉના સંબોગ માટે તે અસરકારક નથી હોતી.

આ રીતે આકસ્મિક ગર્ભ નિરોધ માટે ગોળીઓ વાપર્યા પછી માસિક ચકના બાકીના દિવસો માટે નિરોધ વાપરો. જે તમને ૧૫ દિવસમાં માસિક ના આવે તો ગર્ભ રહી ગયો હશે. છતાં નક્કી ના થાય ત્યાં સુધી નિરોધ વાપરવાનું ચાલું રાખવું જેઠાંએ.

ઇમર્જન્સી ગોળી કેવી રીતે લેશો ?

ઓઈ માત્રાવાળી ગોળી (લો-ડોઝ ગોળી) : ચાર ગોળી (એટલે કે ૩૫ માઈકોગ્રામ ઇસ્ટ્રોજન/ઇથીનાઇલ એક સાથે લો અને ૧૨ કલાક પછી ફરી બીજી ચાર ગોળી લેવાની હોય છે. બજરમાં તે જુદા જુદા નામે વેચાય છે. લો-ઓવરાલ, લો-ફેમીનાલ, માઈકોજુનોન ૩૦, માઈકોઓવલાર, નીઓકોન, ઓર્થોનોવમ ૧/૩૫, ૧/૫૦, વગેરે.

અથવા

વધુ માત્રાવાળી ગોળી (હાઈ-ડોઝ ગોળી) : બે હાઈડોઝ ગોળી (એટલે કે ૫૦ mcg) એક સાથે લઈ લો. ૧૨ કલાક પછી બીજી બે ગોળી લઈ લો. બજરમાં મળતી આ ગોળીના નામ છે. ઓવરાલ, પ્રાઈમઓવરાલ, ફેમીનાલ, નોર્મેસ્ટ્રીન, ઓવકોન ૫૦, નોર્ડીયલ, યુજનોન, નીઓજુનોન વગેરે.

આ ગોળીઓથી તમને માથાનો દુઃખાવો અને ઉબકા થઈ શકે છે. માટે ખાલી પેટે ગોળી ના લેવી. આ ગોળીની સાથે ઉલ્ટી અટકાવવા માટેની ગોળી લેવાથી પણ ફાયદો થાય છે. જે ગર્ભનિરોધક ગોળી લીધાના ત કલાકમાં ઉલ્ટી થઈ જય તો તમારે તે ગોળીઓ ફરી લેવી પડે છે.

બીજી રીતો :

મિની પીલ (ફક્ત પ્રોજેસ્ટીનવાળી) આ ગોળીઓમાં ઇસ્ટ્રોજન હોતું નથી. તેથી તેનાથી ઉલ્લી-ઉભકાની ફરિયાદ રહેતી નથી. સાધન વાપર્યા વગર કરેલા સંભોગ પછી ૪૮ કલાકમાં નીચે પ્રમાણે ગોળીઓ પૂરી કરો તો જ ગર્ભની સંભાવના રહેતી નથી. ૨૦ મિની પીલના પ્રથમ ડોઝ પછી ૧૨ કલાકમાં બીજી ૨૦ મિની પીલ લેવાની છે.

ફેંચપીલ કે R.U. 486 (મિફેન્ડ્રીસ્ટોન) બીજી બધી ગોળીઓ કરતા ઓઈ આડઅસર આપે છે. સંભોગ પછીના ૩ દિવસમાં ૬૦૦ મિલીગ્રામનો એક જ ડોઝ લેવાનો છે.

ગર્ભશયમાં મૂકવાના સાધનો (કોપર ટી) : માસિક આવ્યા પછી ૫ દિવસમાં જે ગર્ભશયમાં કોપર ટી મૂકાવી દેશો તો પણ ગર્ભ સ્થાયી થશે નહીં. જે તમને જતીય રોગ અથવા પ્રજનન માર્ગનો કોઈ પણ ચેપ હોય તો કોપર ટી મૂકાવવી નહીં. કોપર ટી ૧૦ વર્ષ સુધી રખાય છે પણ સામાન્ય કોપર ટી દર ત્રણ વર્ષે બદલાવી નાંખવી જોઈએ. ઘણીવાર, સંભોગ કર્યા પછી તરત જ ૨-૫ દિવસની અંદર તમે કોપર ટી મૂકાવી દેશો તો ગર્ભ સ્થાયી થઈ શકતો નથી અને ગર્ભાધાન રહેતું નથી. છેલ્લી જાણકારી મુજબ, હવે કોપર ટી (૩૮૦-એ) ૮ થી ૧૦ વર્ષ સુધી ચાલે તેવી સરકારી દવાખાનામાં મફત પણ મળે છે.

૧૧.૦ કુટુંબનિયોજન માટે નવી રીતો

ગર્ભનિરોધ માટે આ રીતે વાપરવાની બીજી પણ કેટલીક નવી રીતો/સાધનો હોય છે. તે બધાં આપણે ત્યાં સહેલાઈથી મળી શકતા નથી. પરંતુ તે વિશેની જાણકારી હોવી જરૂરી છે. જેથી તેને માટે એક માંગ પણ ઉભી કરી શકાય. ઉપયોગ વધે, માંગ વધે, તો કિંમત પણ ઘટે.

૧. એલાસ્ટિક નિરોધ : સરસ પાતળા પડના પોલીયુરેથેનમાંથી બનેલા નિરોધ આવે છે. તે વધુ સારા છે કારણકે, ગરમી કે તેલની અસર તેના પર થતી નથી. વળી તે વાપરવામાં વધુ મજનું આવે તેવા છે.

૨. અઠવાડિયે એક ગોળી : દરરોજ લેવાની ગોળી કરતાં ઓઈ અસરકારક ગોળી છે. તેમાં ફક્ત ઇસ્ટ્રોજન છે અને તે ગર્ભને સ્થાયી થવા દેતો નથી.

૩. યોનિમાં મૂકવાની રીંગ : આ રીંગ એક જ સાઇઝમાં મળે છે. તેનો ફાયદો એ છે કે સ્ત્રી એને જાતે પહેરી શકે છે. એક રીંગથી ઉ માસ સુધી ગર્ભનિરોધ કરી શકાય છે.

કોઈપણ સાધન વાપરતાં પહેલાં તે અંગેની તમામ માહિતી મેળવી લેવી જોઈએ. વળી કેટલાક સાધનો માટે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. તમામ માહિતી અને સલાહ લીધા બાદ તમારે જાતે નક્કી કરવાનું છે કે તમે કયું સાધન વાપરશો. એ તમારો હક્ક છે.



જાણકાર વ્યક્તિ દ્વારા માનસિક એકો હશે તો બેનો કોઈ પણ પદ્ધતિ લાંબો સમય વાપરી શકશે. તેનાથી તેનું સ્વાસ્થ્ય પણ સુધરશે.

કુટુંબ નિયોજન

૧૨.૦ તમારે માટે ગર્ભનિરોધની શૈષ્ઠ પસંદગી

આ પ્રકરણ વાંચ્યા પછી પણ નીચે આપેલા ચાર્ટમાં તમારે કેવી રીતે અને કઈ પદ્ધતિ પસંદ કરવી જોઈએ તે વિશે દૂંકમાં આપેલ છે તેનો અભ્યાસ કરશો તો ઘણી મદદ મળશે.

| તમારી જરૂરિયાત | તમારી પસંદગીની પદ્ધતિ | શું ના પસંદ કરશો. |
|---|--|----------------------------------|
| તમારા પતિ ગર્ભનિરોધ બાબતે કોઈ જ પ્રયત્ન કરવા નથી ઈચ્છાતા | આડશાટોપી, સ્ત્રી નિરોધ, કોપર ટી, અંતઃખાવી પદ્ધતિ | કુદરતી પદ્ધતિ, પુરુષ નિરોધ |
| સામાન્ય માસિકના દિવસો ઉપરાંત વર્ચ્યે વર્ચ્યે લોહી પડવાથી તમને મુશ્કેલી થાય છે. | આડશાપદ્ધતિ, કોપર ટી | અંતઃખાવી પદ્ધતિ |
| હું તમારે બાળકની જરૂર નથી | નસબંધી, ઈમ્પ્લાન્ટ, કોપર ટી, ઇંજેક્શન | ગોળીઓ લેવી, નિરોધ, કુદરતી પદ્ધતિ |
| યોનિને અડવાની જરૂર નથી તેવી પદ્ધતિ જોઈએ છે. | અંતઃખાવી પદ્ધતિ, પુરુષ નિરોધ | આડશાટોપી, સ્ત્રી નિરોધ |
| તમારા સાથીને તમે સંબંધ ન કરવા કે વર્ચ્યેથી શિશ્ચ બહાર લઈ લેવા તમે કહી શકતા નથી. | કોપર ટી, અંતઃખાવી પદ્ધતિ | આડશાપદ્ધતિ, કુદરતી પદ્ધતિ |
| તમારા સાથી બીજા સાથે સંબંધ કરીને આવ્યા છે તો તમને જાતીય રોગ થવાની ચિંતા છે. | સ્ત્રી કે પુરુષ નિરોધ | કોપર ટી, અંતઃખાવી પદ્ધતિ |
| તમને એકથી વધુ સાથી જેઠે સંબંધ છે અને જાતીય રોગ પણ થાયેલો છે. | ” | ” |

| તમારી જરૂરિયાત | તમારી પસંદગીની પદ્ધતિ | શું ના પસંદ કરશો. |
|--|--|---------------------------------------|
| એકાદ વર્ષમાં બાળક જોઈએ છે. | સ્વી કે પુરુષ નિરોધ, આડશાટોપી, મિનીપીલ, કે કુદરતી પદ્ધતિ | કોપર ટી, ઈજેક્શન, ઇમ્પ્લાન્ટ |
| તમે બાળકને ધાવણ આપો છો | ” | મિશ્ર ગોળી, ઈસ્ટ્રોજન વાળા ઈજેક્શન |
| હજ તમને બાળક થયું જ નથી. | અંતઃખાવની પદ્ધતિ, નિરોધ | કોપર ટી |
| દરરોજ તમારે યાદ રાખવાની ઝંઝટ નથી જોઈતી. | કોપર ટી, ઇમ્પ્લાન્ટ, ઈજેક્શન | ગોળી, કુદરતી પદ્ધતિ |

તમે તમારા માટે પદ્ધતિની પસંદગી કરી લીધા પછી



ગર્ભનિરોધની દરેક પદ્ધતિ અંગેની સૂચનાઓ બરાબર સમજે અને તે પ્રમાણે કરો. તમારે તે અંગે કોઈ પ્રશ્ન હોય તો સૂચનાઓ ફરી ફરીને વાંચો અથવા આરોગ્ય કાર્યકરને પૂછો. તે તમને બધું સમજનવશો.

કુટુંબ નિયોજન

૧૩.૦ પરિવર્તન માટે પ્રયાસ

મોટેભાગે આપણે જેઠાં છીએ કે સ્ત્રીઓ અને પુરુષોને ગર્ભનિરોધના સાધનોની પૂરી જણકારી ન હોવાથી, તેઓ તેનો સમયસર ઉપયોગ નથી કરી શકતાં. ધણી વાર આ સાધનો અને સેવાઓ ઉપલબ્ધ નથી હોતી તેથી તેનો ઉપયોગ નથી થતો.

તમે આરોગ્ય કાર્યકર તરીકે આટલું જરૂર કરી શકો :

લોકોમાંથી જ એકબીજાની મદદ માટે જુદા જુદા જૂથો બનાવો. આ જૂથમાં શરૂઆતમાં તમે પોતે શીખવાડો અને ત્યાર બાદ જૂથમાંના જ કોઈ સભ્યને શીખવવાનું કામ સૌંપો.

- * શિક્ષણ આપી શકો. : જુદા જુદા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા લોકજગૃહિ આવે છે. લોકો ગર્ભનિરોધ સાધનોનો યોગ્ય ઉપયોગ કરી રીતે કરી શકે તે શીખવાડો.
- * ગર્ભનિરોધના સાધનો ઉપલબ્ધ કરો. તે માટે ગામ/વસ્તીમાં સ્વયંસેવકો તૈયાર કરો.
- * પુરુષ સ્વયંસેવક અન્ય પુરુષોને ગર્ભનિરોધ અંગે સારી રીતે માહિતી આપી શકે છે. તેમના દ્વારા “મર્દાનગી” અને કુટુંબ અંગેના પરંપરાવાદી વિચારોને બદલો.
- * સ્થાનિક ધાર્મિક માન્યતાઓને લક્ષ્યમાં રાખીને તમારા શૈક્ષણિક મુદ્દાઓને તૈયાર કરો અને લોકોને તે શીખવો.

ગર્ભનિરોધથી ફક્ત સ્ત્રીનું સ્વાસ્થ્ય જ નથી સુધરતું. બલ્કે, સ્ત્રી-પુરુષ બનેનું સહજીવન સુધરે છે.

